

ગિરનાર ચેતપ્રવાદિ

સં. વિધાની વોરા

અજાત કર્તાની આ કૃતિ ડેવળ પરમીસ ગાથાની જ છે, જ્તાં તીર્થના ધર્તિહાસની દઘિએ માહિતીસભર હોઈ, મહત્વની છે. સાઠી અને સરળ એવી આ રચના સાહિત્યિક દઘિએ ખાસ નોંધપાત્ર નથી, તો પણ પ્રાસ (એકાદ સ્થાનાપવાદ સિવાય) તૂટો ન હોવાથી ગેય અને સુવાર્ય છે; જંદ 'દોધક' છે.

મંત્રીશ્વર વસ્તુપાળના ગિરનારના શિલાદેખે (સં. ૧૨૮૮/ઈ. સ. ૧૨૩૨), મંત્રીશ્વરના કુલયુદ્ધ નાગેન્દ્રગઢીય વિજયસેનસ્કુરિ કૃત 'રૈવંતગિરિ રાસ' (આ. સં. ૧૨૮૮/ઈ. સ. ૧૨૩૨]^૧, ધર્મધોપસ્કુરિ કૃત 'ગિરનારકદ્વય' (૧૩મી શતાબ્દીનું ત્રીજું ચરણ)^૨ જિનપ્રલસસ્કુરિ રચિત 'રૈવતકદ્વય' અને અન્ય રચનાઓ (તેરમા શતકનો અંત અને ચૌદ્દમા શતકનો પ્રારંભ),^૩ અજાત કર્તાનો 'પેથડરાસ' (આ. સં. ૧૩૬૦/ઈ. સ. ૧૩૦૪),^૪ અંધ્રદેવસ્કુરિ કૃત 'સમરારાસુ' (આ. સં. ૧૩૭૧/ઈ. સ. ૧૩૧૫),^૫ — આદિ રચનાઓમાં ગિરનારના જૈનમંદિરો વિશે નોંધ મળે છે.^૬ એકંદરે તો આ સૌ ગિરિરથ તીર્થલવનો વિશેની નોંધિમાં સમાન કથનો મળે છે.

આ સિવાય હેમહંસ કૃત 'ગિરનાર ચેત પરિપાઠી' (આ. સં. ૧૫૧૫/ઈ. સ. ૧૪૫૮),^૭ અને રતનસિંહસ્કુરિ શિષ્યે રચેલી 'ગિરનાર તીર્થમાલા' (આ. સં. ૧૫૨૩/ઈ. સ. ૧૪૬૭)^૮માં ઉપર્યુક્તા રચનાઓમાં અપાયેલ સામની ઉપરાંત પંદરમા શતકમાં ગિરનાર પર બંધાયેલ ભીજાં પણ કેટલાંક મંદિરોનો ઉલ્લેખ છે. આ બધી જ કૃતિઓનું સમાંતર પઠન રસપ્રદ અને નોંધનીય અની રહે છે. આગળ વિશેષ ચર્ચા કરતાં પહેલાં સાંપ્રદત કૃતિ વિશે થોડી પ્રારંભિક વિગતો જોઈએ.

સાંપ્રદત પ્રતિ પાઠખના 'શ્રી હેમચંદ્રાચાર્ય' જૈન ગ્યાનમંદિરમાંની શ્રીસંઘ જૈનલંડારની ક્રમાંક ૩૧૩૨, ડા. ૧૧૪ની છે. 'અર્થુદ્ધાયલ વિનતી સંભળ આદિ વિનતી સંભળ' એવું આ પ્રતિનું શીર્ષક છે, જેના છેલ્લા પત્રમાં પ્રસ્તુત કૃતિ 'ગિરનાર ચેત પ્રવાદિ' નામે છે. પ્રતિનું માપ ૨૬.૫ × ૧૧.૫ પત્ર ૮ છે. સરાસરી દરેક પત્રમાં ૧૮ લિટી અને દરેક લિટીમાં પણ અક્ષર ૨ છે. પ્રતિની લેખનશૈલી સોળમા શતકની છે; પરિપાઠી જૂની શુભરાતીમાં નિષ્ઠા છે.

આ કાવ્યમાં રચના સંબંધિત આપેલે નથી પરંતુ, હેમહંસે 'ગિરનાર ચેત પરિપાઠી'માં અને અને રતનસિંહસ્કુરિ શિષ્યે 'ગિરનાર તીર્થમાલા'માં – પંદરમી સફીમાં બંધાયેલાં જે ત્રણ મંદિરોનો ઉલ્લેખ કર્યો છે, એ મંદિરોનો ઉલ્લેખ આ કાવ્યમાં કરવામાં આવેલો નથી. એ ત્રણ મંદિરો તે નરપાસ સંધ્વી, સમરસિંહ-માલદે, અને લુલબ શાખુરાજનાં છે. એ સમયના પ્રચ્છાતા આ મંદિરો આ કાવ્યની રચના સત્યે હજુ બંધાયેલાં નહિ હોય. ઉપરાંત ભાષાની દઘિએ પણ આ કૃતિ આગળની એને સુકાખલે વહેલી રચાયેલી લાગે છે. એટલે કે પંદરમી સફીના પ્રારંભ કાળની કે એ પહેલાંની આ કૃતિ સંસ્કરણની શરીર. પ્રતિના અન્તલાગે "જ્યાનંદ્ગણિઓ લખ્યું" એમ નોંધ છે. આ સમયમાં થઈ ગયેલા જ્યાનંદ્ગણિ તે તપાગઢીય સોમતિલકસ્કુરિના શિષ્ય જ્યાનંદ્ગણિ હોવા જોઈએ જેમનો સુવર્ગપાસ સં. ૧૪૪૧/ઈ. સ. ૧૩૮૫માં થયો છે. આ વાત ધ્યાનમાં લઈએ તો આ કૃતિ તે પહેલાંની હોય.

કર્તા ડેઝાઈ જૈન યાત્રિક કવિ છે અને તેમનો સમય આગળ નિર્દેશેલા હેમહંસની પાસેનો હોય એમ તેમણે આપેલી નોંધે અને કૃતિની સરાસરી ભાષા ઉપરથી જ્યાનંદ્ગણિ હોવા જોઈએ.

તીર્થાટનની દાખિયી લખનાર આ કવિ વાચ્યકને, ‘જુણુ’ પ્રાકાર’ (ઉપરડોટ)થી તળેઠી સુધી થઈ, ગિરનાર ઉપર જવાની પાજ સુધીમાં વચ્ચે આવતાં સ્થાનોની ભણુ કરાવે છે. ઉપરડોટના તળપ્રહેશમાં આવતાં ત્યાં મંત્રી તેજપાળે વસાવેલ ‘તેજલપુર’, મંત્રીએ પોતાની માતાના નામ પરથી કરાવેલ ‘કુમાર સરૌવર’, પાર્શ્વનાથનું મંદિર (આસડરાજ વિહાર) તેમ જ ઉપરડોટમાંનું ‘મહાવીર સ્વામી’નું મંદિર, દામેદર કુંડને કાંડે કાળમેઘ ક્ષેત્રપાલનું સ્થાનક વગેરે નોંધી ગિરનારની પાજ ઉપર ચઢતાં અન્ય અવલોકનો નોંધે છે.

સૌ પ્રથમ ગિરનાર ચ્યદ્વાની પાજના નિર્માતા વિશે માહિતી આપતાં પરિપાઠી કર્તા કહે છે, કૃ બાહુડે (વાંભદુ મંત્રીએ) એ સમરાવી. જ્યારે ‘રેવંતગિરિરાસ’માં અંબડ મંત્રીએ કરાંબ્યાનો ઉલ્કેખ છે.^{૧૦}

હવે કવિ ડોટની કુંડ પાસે આવી પહોંચતાં, દૂરથી હેખાતાં દહેરાંતાં સુવર્ણમય ફંડકળશનો નિર્દેશ કરે છે; અને રત્નાશ્વરાં નેમિનાથના બિંભનો જુણ્ણોદ્વાર કરાવ્યો એ અનુશ્રુતિનો ઉલ્કેખ કરે છે. પછી ત્યાં આગળ ‘આપાપામઢ’નો ઉલ્કેખ કરે છે. આ રચના શું હશે એ સુદ્ધો વિવાદાસ્પદ બન્નો છે, લેણું ચર્ચા અગાઉ પુરાતત્ત્વ (લા.૧ પૃ. ૩૦૮-૩૦૯)માં પં. બેયરદાસ દ્વારીએ કરેલી છે. પંડિતજીએ ત્યાં હોઈ પ્રપાનો સંબંધ કલ્પ્યો છે.

એ પછી કવિ ડોટ અંતર્ગતનાં મંદિરોની વાત કરે છે. તેમાં સૌ પ્રથમ તીર્થધિય નેમિનાથ અને જમણીબાજુએ રાજુમતીનું દહેરું અને નેમિનાથનું ‘કલ્યાણુન્ય’નું સચિવેશ્વર વસ્તુપાળે કરાવેલ^{૧૧} મંદિર, ગજપાદ (કુંડ), નાગઝરા મોરઝરા...નો ઉલ્કેખ, તદનિરિક્ત વસ્તુપાલકારિત શત્રું જ્યાવતાર ઓ આહીયરનું ભવન, વીરજીનેન્દ્ર (સત્યપુરાવતાર), વીસ જિન સાથે સમેતશિખર અને ચતુર્વિંશતિ જિન સાથેના અષ્ટાપદ પ્રાસાદ, તેમ જ મરુદેવી અને ભરતેશ્વરનાં દેવગૃહોનો ઉલ્કેખ પણ કરે છે. ત્યાર પછી રથનેમિને નમસ્કાર કરી, લખાવન (સં. લક્ષ્મારામ) અને સહસ્રાવન (શૈવન/સં. છે. તરફ જતાં પહેલાં, અવલોકન શિખર (શુરુદાતાન્ય), શાખ્ય (ગોરખનાથ) અને પ્રધુમન (એઘડનાથ) શિખરોને પ્રણામી પછી સહખ્યાભિન્દુગુણી (વર્ત્માન સાતપુડાની જગ્યા?) અને ચંદ્રયંકા નેઈને છેવટ યાવાની ઇણશ્રુતિ આપી, કવિ કૃતિ સમાપ્ત કરે છે.

આ કૃતિ વાંચ્યા પછી, એ એક સ્થાનની પીછાનો પ્રયત્ન કરી જેવો જરૂરી અને છે. (૧)
સહખ્યાભિન્દુ ચુક્ષા : (કડી ૨૪.)

એ અત્યારે જ્યાં સાતપુડાની જગ્યા છે, તે જ મોટે ભાગે હોઈ શકે. કોટથી અંભાજી શિખર જવાના રસ્તામાંથી વચ્ચેથી આ રસ્તો ફંડાઈને ‘સાતપુડા’ તરફ જય છે, અને ખીલે જે ‘કાળિકા’ તરફ જય છે, એ અંભાજીથી ગોરખનાથ જવાના રસ્તામાંથી ફંડાઈ જય છે.

સાતપુડા કે સહખ્યાભિન્દુગુણીની વાત કરીએ તો — કોટથી થોડું ઉપર ચઠીને અખીબાજુએ પદ્ધતરચૂટી જવાય અને જમણીબાજુએ જટાશંકરની ધર્મશાળા પાસેથી થોડું નીચે જિતરીને જવાય પણ રચાયેલી જવાય અને જમણીબાજુએ જટાશંકરની ધર્મશાળા પાસેથી થોડું નીચે એ શિલાઓમાંથી છે. મોટી મોટી શિલાઓના બનેલી, શંકુ આકારની બખોલ જેવું છે એમાં નીચે એ શિલાઓમાંથી છે. મોટી મોટી શિલાઓના બનેલી, શંકુ આકારની બખોલ જેવું છે એ શિલાઓમાંથી છે. (આ ખાબોચીયું ઉત્તાળામાં સતત ટપક્યા કરતા પાણીને લીધે મોટા ખાબોચીયા જેવું થયું છે. (આ ખાબોચીયું ઉત્તાળામાં પણ પાણીથી લરેલું રહે છે) એટલે ‘સહખ્યાભિન્દુ’ નામ બ્યાજળી છે અને મોટી મોટી સાત જેટલી શિલાઓની બનેલી એ જગ્યા હોવાથી અત્યારે ‘સાતપુડા’ નામ પ્રયુક્તિ થયું હશે. અને રસ્તો પગથીયાં વગરનો છે અને ત્યાંનું વાતાવરણ આહલાદક છે.

કાળકા (કડી ૪) — ૨. હવે ખીને રસ્તો ને 'કાળકા' તરફ જાય છે, એ કાળકાનું સ્થાનક પણું ગુદ્ધ જેવું છે. એને કાવ્ય-પ્રચલિત ચંદ્રગુદ્ધ હોવાનું અનુમાન કરવાનું મન એટલા માટે થાય છે કે, એનો રસ્તો સહખ્યાબિન્દગુદ્ધ સાથે સમાંતર જ ફંટાય છે અને દરેક કાવ્ય આ બન્ને ગુદ્ધનો સાથે સાથે ઉલ્લેખ કરે છે. એ સિવાય એને માટે, સાતપુડા માટે આપું એવું જોરદાર ખીજું પ્રમાણ નથી.

ભરતેશ્વર (કડી ૧૫-૧૭) — ૩. આપણું આ પરિપાઠીમાં ભરતેશ્વરનો ઉલ્લેખ છે, તે પણ ખીને નથી. તેમ જ સત્યપુરાવતાર વીરજિનેન્દ્રનો ઉલ્લેખ પણ થોડાક અપવાદ સિવાય કથાંય મળતો નથી.

પાજ. (કડી. ૬) — ૪. ગિરનારની પાજ માટે સામાન્ય મત અંભડે તે સમરાવ્યાનો છે. પ્રસ્તુત કાવ્યમાં બાહુડે તે બંધાવ્યાનો ઉલ્લેખ છે.^{૧૩} અત્યારે પણ ખીને રસ્તો બોરહેવી પાસેથી જાય છે.

૫૧૬ દિચ્યાણી

૧. પ્રાચીન ગ્રંજર કાવ્યસંશેહ (કાવ્યમાળાનું પુસ્તક ૧૩મું) સંપા. સી. ડી. દલાલ, વડોદરા - ઈ. સ. ૧૯૨૦ - પૃ. ૧.
૨. એજન. Appendix 7 p. 19.
૩. એજન. Appendix 5 p. 15.
- ૪અ. એજન. Appendix 10 p. 24.
- ૪બ. 'વ્યાપણું કલિઓ' — લે. કે. કા. શાસ્ત્રી અમદાવાદ - ૧૯૪૨. પૃ. ૧૬૬-૧૬૭.
૫. પ્રા. ગુ. કા. સં. ભાગ ૧૩ પૃ. ૩૪ (નવમી ભાગા.).
૬. આ સિવાય પણ વસ્તુપાળ-તેજપાળની પ્રથસ્તિઓમાં ગિરનારના તેમણે કરાવેલ જિનાસથે આદ્વિત રચનાઓના ઉલ્લેખો મળે છે.
૭. પુરાતત્વ ભાગ ૧ અમદાવાદ સં. ૧૯૭૮,, પૃ. ૨૮૩.
૮. પ્રાચીન તીર્થમાળા સંશેહ ભા. ૧; સંપા. શ્રી વિજયધર્મસૂરી, ભાવનગર, સં. ૧૯૭૨, પૃ. ૩૩.
૯. પ્રા. તી. સં. પૃ. ૫૭ની પાદટીપ.
૧૦. પ્રા. ગુ. કા. સં. પૃ. ૨.
૧૧. અન્ય કૃતિઓમાં એને શિલાલેખો તેમજ ખીનાં પ્રમાણું દારા એ બાબત સિદ્ધ છે કે એ મંદિર તેજપાળ બંધાવું છે.
૧૨. પં. બેચરદાસ દોશી, પૃ. ૨૬૪-૨૬૫.
૧૩. જૈન તીર્થ સર્વસંશેહ ભા. ૧., અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૨૫-૧૨૬.

ગિરનાર ચેતપ્રવાહી

સમરવિ સામિય સામલણ	અંભિકિ હીઠ ધરેવિ
મહાતીરથ ગિરનારગિરે	તીરથ શુણુણ સવેવિ ૧
કુયર સરૈવર કલસ લરે	તેજલપુરિ પહુ પાસો
નૃવણુ વિદેવણુ પૂજ કરી	જિમ હુઠ વિધન-વિષુાસો ૨
તણ ગિરનારહ તલહટીય	જે જરણુ-પ્રાકારે
નેહારિય જુગાદિ-જિણુ	તે જર્દ લવપારે ૩
તાછે ત્રિસલાદેવિ-તણું	ભવીણ નયણુણુદે
ભાવિહિ લગતિહિ લેટિય એ	સામી વીર જિણુંદે ૪
સોબનરેખનંદ લહિય એ	દેવ દામોદર નામિદ્ય
કાલમેઘ-ક્ષેત્રપાલ તહિં	સોહંદ બહુ આરામિદ્ય ૫
બાહુડદેવિહિં સોહલિય	નવી કરાવી પાજ
વિસમણ મારગ સમ કિઉ	ગિરનારહ ગિરિજાજ ૬
પરવહું પરવહું લાવિય જિણુ	સયલ શલિલુ પીયંતે
ગિરિ વાદ્ય ગહગહિય મનુ	ગિરિવિરિ સહિરિ ચડંતે ૭
નેઈ બાણુ હર મણુ-હરણુ	ઉજલિગિરિ કિવલાસ
દાંડકલસ સોબનમ એ	અગહ મનિ પૂળી આસ ૮
રેવધગિરિ દુલિયામણું	જસ સિરિ જાહવરાણ
નેમિ જિણેસર પણુમિદ્ય એ	હિઠ ધરેવિણુ લાઉ ૯
આહેસિદ્ય અંભિકતણુંદ્ય	રતનિહિ આહ્યી બિંબ
ભાવીસમણ તીથયરો સો	પુજિસુ અનિદાંદો ૧૦
પાખલિ ક્રિતી દેહુરિય	આપાપામણ માહિ
જે કિવિ બિંબ રે જીવ તુંથ	તે સંદે આરાહે ૧૧
દેવહું દાહિણુ દેહૂરિય	જે રાઈમાં નમંતિ
સિદ્ધિરમણુસિઉં તીહ નર	સહીયા અવિહુડ હુતી ૧૨
વસ્તિગ માંત્રિહિ કારવિહ	દેવહ પય કીય સેવ
પ્રહિ જેઠેવિણુ પણુમિસિઉ	કલ્યાણુત્રય દેવ ૧૩
નાગજરિ નાહીઉ મોરજરે	અમિઉ કુડ પડિછંદો
કલસ લરેવિ ગાઢદમ એ	નૃવિસિઉં નેમિ જિણુંદો ૧૪

એક લુલ કિમ વજીઈએ	વસ્તિગમંત્રી-વિચારો
જોજલિગિરિ જિણું નિભમતીયા	સિત્રુંજ્ય-અવતારો ૧૫
જિણુભેદ પાસઈ સંમેયસિહુરે	વીસ જિણુંદ નમેસો
ડાળદી પાસઈ ચઉલીસ જિણું	અષ્ટાપદ પ્રથમેસો ૧૬
પાછલિ મેગલિ આરુહિય	માડી છઈ મરુદેવિ
ખૂજિસુ લરથેસરિ-સહિય	કુસમદ કરંડ લરેવિ ૧૭
સંઘડ સામિધુ જે કરએ	વિધન તણું અપહારો
ફલિ નાલીયરે લેટીઈ એ	કવડુ જખ પડિહારો ૧૮
તીછે અછદ રવિમાયે	મહિનેદિર મેડંત
કન્જલ વંને અંસજલે	ગિરિ નીજરણું ઝરંત ૧૯
જે પ્રતિણોધીય રાયમાયે	ધંધવ તેરં નેમિ
જિમણુંદ પાસઈ દેહૂરિય	વંદિસુ સો રહૂનેમિ ૨૦
વેઢલ વજલ નિભમાલીય	પાડલ જૂહી જાઈ
કુંદ-મચ્યકંદહ સહીય	તહીં સોહીય વણુરાય ૨૧
સંઘડ વિધન-વિષ્ણુસણીય	ટાલદી અલી[થ] સવેવિ
ઠોઠસુ નેવજ-નાલીયર	આગલિ અંધિક દેવિ ૨૨
તાહીં આગલિ અવદૈખુસિહુરિ સામિ-પજૂન નમેસો	
સિદ્ધ વિષ્ણુયાગ સો લહીય એ જે સાહસઈ સંપન્તુ	૨૩
દેખીય લખારામ-વનુ	દુયડઉં સહસારામુ
સહસભિંદુ ગુરુ જેઈયએ	ચંદ્ર ગુરુ અલિરામુ ૨૪
ઇણું પરિ રેવઈ-ગિરિસિહુરે ચેતપ્રવાડી કરંતે	
તીરથ જ્યાત્રા તણું ફ્લો। તીહંનર નિશ્ચદ હુંતે	૨૫
॥ ઈતિ ગિરનાર ચેત-પ્રવાડી જ્યાણુંદગણું લખિતા ॥	